

GJKT090018902025



રજુ કર્યા તારીખ: ૦૧ ૧૦ ૨૦૨૫
 દાખલ કર્યા તારીખ: ૦૧ ૧૦ ૨૦૨૫
 ફેસલ કર્યા તારીખ: ૧૨ ૦૩ ૨૦૨૬
 સમયગાળો: વર્ષ માસ દિવસ
 ૦૦ ૦૫ ૧૧

ભચાઉના મહે. એડીશનલ સીનીયર સીવીલ જજ સાહેબશ્રીની કોર્ટ,
મુ. ભચાઉ-કચ્છ.

રેગ્યુલર સમરી સ્યુટ નં. ૧૦/૨૦૨૫
આંક : ૨૯

(૧) બેંક ઓફ બરોડા.
 ભચાઉ બ્રાન્ચના
 મેનેજર શ્રી યોગરાજ બબુએલાલ મંડલ,
 ઉ.વ.-૩૯, ઘંધો-નોકરી- બેંક ઓફ બરોડા.
 ભચાઉ બ્રાન્ચ, તા.ભચાઉ, જી. ભચાઉ.

::: વાદી.

-:: વિરૂધ્ધ ::-

(૧) પરબતભાઈ જગાભાઈ ચાવડા (બોરોઅર),
 ઉ.વ.-૪૯, ઘંધો -ખેતી,
 રહે. ૬૨, ચાવડાવાસ, બાંધડી, તા. ભચાઉ-કચ્છ.
 ::: પ્રતિવાદીઓ

દાવો ::- રૂ. ૨,૨૬,૭૮૫.૩૮/- વસુલ કરવા માટે

 વાદી તરફે વિદવાન વકીલ શ્રી :- પી.એમ.મહેશ્વરી.

પ્રતિવાદી તરફે :- એક તરફી.

// ચુ કા દો //

- (૧) વાદીઓના દાવાની ટુકમાં હકીકત એવી છે કે, વાદી બેંકીંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ હેઠળ એક બેંકીંગ સંસ્થા છે વાદી બેંકીંગ ક્ષેત્રને લગતી સેવાઓ આપવાનું કામ કરે છે અને જેની મુખ્ય ઓફીસ બરોડા માં આવેલ છે તથા તેની બ્રાન્ચ ઓફીસ ભચાઉ તા. ભચાઉ, જ.કચ્છ મુકામે આવેલ છે. હાલનો દાવો વાદી સંસ્થાના બેંક ઓફ બરોડા ની બ્રાન્ચ **ભચાઉ ના** મેનેજરશ્રીનાઓ અધિકૃત વ્યક્તિએ હાલનો દાવો દાખલ કરેલ છે.
- (૨) આ કામના પ્રતિવાદી લોન લેનાર. આ કામના પ્રતિવાદીએ વાદી બેન્કનો સંપર્ક કરેલ અને "**BHFKCC**" લોન યોજના અંતર્ગત રૂપિયા ૧,૫૦,૦૦૦/- ની લોન લીધેલ હતી વાદી બેંકને નિયમોનુસાર તમામ જરૂરી દસ્તાવેજો પર એમની સહી કરી આપેલ છે અને આ લોન વ્યાજ, ખર્ચ, ચાર્જ વગેરે સહીત ચુકવી આપવાની ખાતરી આપેલ હતી. વાદી બેન્કને તે માટે જરૂરી દસ્તાવેજો વાદી બેન્કની તરફેણમાં કરી આપેલ અને પુરા પાડેલા હતા.
- (૩) આ કામના પ્રતિવાદી સદરહું લોન તથા તે પરના નિયમનુસાર વ્યાજની રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ ગયેલ છે. આથી વાદી બેંક બાકી રહેતી રકમ નીચમ અનુસાર વ્યાજ સહીત રૂ. ૨,૨૬,૭૮૫.૩૮/- (અંકે રૂપિયા બે લાખ છવીસ હજાર સાત સો પંચાસી અને આઠત્રીસ પૈસા પુરા) વસુલ લેવા માટે હાલનો સમરી દાવો કરેલ છે.
- (૪) આ કામે વાદી તરફે હાલના પ્રતિવાદીને બજીવણી કરવા રજી.પોસ્ટ.એડીથી અરજી આપેલ છે જે મંજૂર કરવામાં આવેલ હતી

અને જે અંગેની બજવણી રજી.પોસ્ટએડીથી કરવામાં આવેલ છે તેવું વાદી તરફે સોંગદનામુ આ કામે રજુ કરેલ છે.

- (૫) આ કામે હાલના વાદીએ અત્રેની અદાલતના ઓર્ડર-૩૭,૩૮-૧,૨ મુજબ સમરી દાવો દાખલ કરેલ છે. વાદીનો દાવો ઓર્ડર-૩૭ ની ૩૮-૨માં જણાવ્યા મુજબના દાવા સમરી પ્રકારના દાખલ થઈ શકે છે. આમ, હાલનો દાવો વાદી બેક સાથે પ્રતિવાદીએ લોન મેળવવા માટે કરેલ કરારમાંથી ઉદભવેલ ચોક્કસ નાણાંકીય રકમ માટેનો છે આથી, હાલનો સમરી પ્રકારનો દાવો ગણી શકાય અને આથી આ દાવાના કામે આંક-૧ નીચે ઓર્ડર-૩૭ ૩૮-૨(૨) મુજબ સમન્સ મુજબ સમરી દાવાની પ્રોસીઝર મુજબ સીવીલ પ્રોસીજર કોડના ફોર્મ નં -૪ એપેન્ડેક્ષ બી મુજબ પ્રતિવાદી બજવણી થયાના ૧૦ દિવસમાં હાજર થવા માટે સમન્સ ઈસ્યુ કરવામાં આવેલ હતો. આમ, આ કામના પ્રતિવાદીને ઓર્ડર-૩૭ ૩૮-૨(૨) મુજબ સમન્સની બજવણી થયેલ છે ત્યારબાદ આ કામે ૧૦ દિવસનો સમય વિતવા છતાં પ્રતિવાદી તરફ કોઈ હાજર થયેલ નથી.
- (૬) આ કામે ઓર્ડર-૩૭,૩૮-૨ મુજબ આ કામના પ્રતિવાદીને બજવણી થયેલ છે છતાં આ કામના પ્રતિવાદી દિવસ-૧૦નો સમય પસાર થવા છતાં હાજર થયેલ નથી. આથી, ઓર્ડર-૩૭ સમરી દાવાની સંબંધે વિશેષ પ્રક્રિયા નક્કી કરેલ છે. આથી, આ કામે ઓર્ડર-૩૭ ૩૮-૨ મુજબના સમન્સની બજવણી થયેલ હોવા છતાં આજદિન સુધી આ કામના પ્રતિવાદી હાજર થયેલ નથી કે લીવ ટુ ડિફેન્સ માટે કોઈ અરજી આપેલ નથી. આમ, આ કામના પ્રતિવાદી ઓર્ડર-૩૭ ૩૮-૨(૩) મુજબ જો ઓર્ડર-૩૭ ૩૮-૨(૨) મુજબનો સમન્સ બજવાની

તારીખથી ૧૦ દિવસની અંદર પ્રતિવાદી હાજર ન થાય તો, પ્રતિવાદી બચાવ કરી શકશે નહીં અને દાવા અરજીમાં જણાવેલ હકીકત પ્રતિવાદી સ્વીકારી લીધેલ છે તેમ ગણાશે. આમ, આ કામે પ્રતિવાદીને સમન્સની બજવાણી થઈ ગયેલ છે આથી ઓર્ડર-૩૭, ૩૯-૨ (૨) મુજબ જો પ્રતિવાદી હાજર ન થાય તો પ્રતિવાદીએ દાવાની હકીકત સ્વીકારી લીધેલ છે તેમ ગણાય અને વાદીનો દાવો સંપૂર્ણ મંજૂર થવા પાત્ર ગણાય. આમ, પ્રતિવાદી આ કામે હાજર થયેલ નથી આથી ઉપરોક્ત ચર્ચા કર્યા મુજબ ઓર્ડર-૩૭, ૩૯-૨(૨) મુજબ દાવા અરજીની હકીકતો પ્રતિવાદીએ સ્વીકાર કરેલ છે તેમ ગણાય અને વાદીનો દાવો મંજૂર થવા પાત્ર છે.

- (૭) ત્યારબાદ આ કામે વાદી તરફ વિ.વકીલશ્રીની મૌખિક દલીલો સાંભળવામાં આવેલ છે.
- (૮) આ કામે ઉપરોક્ત ચર્ચા કર્યા મુજબ ઓર્ડર-૩૭, ૩૯-૨(૨) મુજબ દાવો મંજૂર કરવા માટની અરજીને પડકારમાં આવેલ નથી. આથી વાદીની આંક- ૧ ની દાવા અરજીની હકીકતને તથા આંક-૧૬ થી આંક-૨૭ વાળા દસ્તાવેજને પ્રતિવાદી તરફે હાજર થઈને પડકારવામાં આવેલ નથી. આ કામે વાદીએ દાવા અરજીની સોગંદ ઉપર હકીકત જણાવેલ છે કે, વાદી બેંકીંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ હેઠળ એક બેંકીંગ સંસ્થા છે વાદી બેંકીંગ ક્ષેત્રને લગતી સેવાઓ આપવાનું કામ કરે છે અને જેની મુખ્ય ઓફીસ બરોડા માં આવેલ છે તથા તેની બ્રાન્ચ ઓફીસ ભચાઉ તા. ભચાઉ, જી.કચ્છ મુકામે આવેલ છે. હાલનો દાવો વાદી સંસ્થાના બેંક ઓફ બરોડા ની બ્રાન્ચ ભચાઉ ના મેનેજર શ્રીનાઓ અધિકૃત વ્યક્તિએ હાલનો દાવો દાખલ કરેલ છે.

તેના સમર્થનમાં આ કામે વાદી તરફે બેંકમાં લોન લેવા માટે આપેલ દસ્તાવેજી કાગળો રજુ રાખેલ હતા અને વાદી લોન ભરપાઈ કરેલ નથી તેના સમર્થનમાં આ કામે આંક- ૩ થી દસ્તાવેજી વાદી રજુ કરેલ છે. અને આ કામ આંક-૧૬ થી આંક-૨૭ વાળા દસ્તાવેજી કાગળો ધ્યાને લીધેલ છે. આ તમામ દસ્તાવેજમાં પ્રતિવાદીની સહી છે અને તેને પ્રતિવાદી તરફે પડકારમાં આવેલ નથી. આથી, તે ન માનવાને કોઈ કારણ નથી. આથી આ કામના વાદીએ તેમના દાવામાં રજુ કરેલ હકીકતનો સ્વીકાર કરેલ છે અને તેના સમર્થનમાં રજુ કરેલ દસ્તાવેજનો પણ વાદીએ સ્વીકાર કરેલ છે તે માનવા પાત્ર થાય છે. જેને પ્રતિવાદી તરફે પડકારવામાં આવેલ નથી. આથી, હાલના બંને દસ્તાવેજો ન માનવાને કોઈ કારણ નથી આથી, હાલનો દાવો સમયમર્યાદામાં દાખલ થયેલ છે.

- (૯) આમ, ઉપરોક્ત ચર્ચા કર્યા મુજબ આ કામના પ્રતિવાદીએ વાદી સંસ્થામાંથી લોન લીધેલ હતી તે ઉપરોક્ત ચર્ચા મુજબ વાદીની દાવા અરજીને પ્રતિવાદી હાજર થઈ પડકોરલ નથી. આથી પ્રતિવાદીએ કબુલ કરેલ છે તેમ ગણાયે. આમ આ કામે વાદી બેંકના પ્રતિવાદી તરફે બાકી રૂા ૨,૨૬,૭૮૫.૩૮/- (અંકે રૂપિયા બે લાખ છવીસ હજાર સાત સો પંચાસી અને આડત્રીસ પૈસા પુરા) તેમની જાત મિલકતમાંથી વસુલ થવાપાત્ર છે. આથી, ન્યાયના હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

-:: હુકમ ::-

- (૧) વાદી કંપનીનો દાવો અંશત : મંજૂર કરવામાં આવે છે.
(૨) આ કામનાં પ્રતિવાદીએ વાદી લેણી રકમ રૂા

૨,૨૬,૭૮૫.૩૮/- (અંકે રૂપિયા બે લાખ છવીસ હજાર સાત સો પંચાસી અને આડત્રીસ પૈસા પુરા) દાવા દાખલ તારીખથી વસુલ મળતા સુધી વાર્ષિક ૧૨% નાં વ્યાજ સહીત પોતાની જાત તથા હરેક પ્રકારની મિલકતમાંથી ચુકવી આપવા તેવો પ્રતિવાદીઓને હુકમ કરવામાં આવે છે.

- (૩) આ દાવાનું તમામ ખર્ચ તમામ પ્રતિવાદીએ જાતે ભોગવવું.
(૪) હુકમ મુજબ હુકમનામું દોરવું.

હુકમ આજ તા. ૧૨ મી, માહે. માર્ચ, સને ૨૦૨૬ ના રોજ ખુદી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો.

તા. ૧૨/૦૩/૨૦૨૬
મુ. ભચાઉ-કચ્છ.

(નરેશકુમાર રામજીભાઈ પટેલ)
એડીશનલ સીનીયર સીવીલ જજ
ભચાઉ-કચ્છ.
જ.જે. ૦૧૪૧૭